https://archive.org/details/bk1233/page/n0/mode/1up

All Items on https://archive.org/details/realpatidar

tidar.com

લક્ષ્મીનારાયણ વિજયતેતરામ્ ॥ ॥ સનાતન પરમો ધર્મ ॥ ॥ શ્રી ઉમિયા માતાય નમઃ ॥

ી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, ઉત્તર સાબરકાંઠા ઝોન (ગુજરાત)

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, દક્ષિણ સાબરકાંઠા ઝોન (ગુજરાત)

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ, સાબર રીજીયન (ગુજરાત)

Full Library on https://realpatidar.com/library

તા. ૩૦-૧-૨૦૧૧
રવિવાર

આજ રોજ તા. ૩૦-૧-૨૦૧૧ ને રવિવારના રોજ સવારે ૯-૦૦ કલાકે મોડાસીયા કડવા પાટીદાર સમાજ કેમ્પસ, ને.હા. નં. ૮, સહકારી જીનની બાજુમાં, **હિંમતનગર** ખાતે મળેલ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, ઉત્તર સાબરકાંઠા ઝોન, શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, દક્ષિણ સાબરકાંઠા ઝોન અને શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ-સાબર રીજીયનને સાંકળતી વિવિધ સમાજો, મહિલા મંડળો અને યુવા મંડળોની એક અભૂતપૂર્વ સભા શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, નખત્રાણાના પ્રમુખ, **પાટીદાર શિરોમણી શ્રી રામજીભાઈ કરમસીભાઈ નાકરાણી**ના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મોટી સંખ્યામાં મહેમાનોની તથા સનાતની જ્ઞાતિજનોની ઉપસ્થિતિ રહી હતી.

આ સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ સર્વે સનાતની ભાઈઓ-બહેનો તરફથી રજુ થયેલ વિચારોનો સારાંશ અને શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, નખત્રાણા (કેન્દ્રીય સમાજ) દ્વારા તા. ૨૫-૩-૨૦૧૦ના રોજ બહાર પાડવામાં આવેલ **શ્વેતપત્ર** તેમજ તા. ૭-૫-૨૦૧૦ની કેન્દ્રીય સમાજની **અસાધારણ સામાન્ય સભા**માં સર્વાનુમતે બંધારણમાં કરાયેલ સુધારાઓ તથા તા. ૧૨-૫-૨૦૧૦ ના જ્ઞાતિના **પંચમ્ અધિવેશન**માં સર્વાનુમતે પસાર કરેલ જ્ઞાતિના રીત-રીવાજોની ૧ થી ૧૯ કલમો અને કેન્દ્રીય સમાજે તા. ૧-૭-૨૦૧૦ના રોજ બહાર પાડેલ આદેશોને અનુલક્ષીને જ્ઞાતિના રીત-રીવાજોની કલમ ૧૮ મુજબ **બાહ્ય આચરણો** અંગે તથા કલમ ૧૯ મુજબ **સામાજીક તથા ધાર્મિક પ્રશ્નો** અંગેનું પાલન ચુસ્તપણે કરવા શ્વેતપત્રમાં જણાવેલ છે.

સમાજ એક જ આચાર અને વિચાર વાળો રહે, સમાજમાં એક જ પ્રકારના રીત-રીવાજોનું અને સનાતન વૈદિક હિન્દુ ધર્મનું ચુસ્તપણે પાલન થાય તે અત્યંત જરૂરી છે. પાલન ન કરનાર વ્યકિત અથવા વ્યકિત સમૂહનું સભ્યપદ રદ કરવાની સમગ્ર જવાબદારી ભારતભરના તમામ ઝોન અને ઝોનમાં આવતા સમાજોને કેન્દ્રીય સમાજ દ્વારા સોંપવામાં આવેલ છે.

કેન્દ્રીય સમાજના આ આદેશોને અનુસરીને અને આજની આ **'સમજે પાટીદાર'** સભામાં થયેલ ચર્ચા વિચારણાના અંતે આજની સભા નિષ્કર્ષ પર આવી **નીચે મુજબના ઠરાવો સર્વાનુમતે પસાર કરે છે.**

મંજુર થયેલ ઠરાવો :

ઠરાવ : ૧ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, ઉત્તર અને દક્ષિણ સાબરકાંઠા ઝોન, શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ, સાબર રીજીયનના સભ્યો **સનાતન વૈદિક હિન્દુ ધર્મ**ને માનતા અને પાળતા કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના વંશજો જ રહી શકશે યા બની શકશે.

ઠરાવ : ૨ આ સમાજ ઝોનોના તમામ સભ્ય પરિવારોના બાહ્ય આચરણો જન્મ થી મરોત્તર સુધી શુધ્ધ વૈદિક સનાતન હિન્દુ તરીકેના હોવા જોઈએ અને પાળવાના રહેશે. તેમ ન કરનાર વ્યકિત આ સમાજ ઝોનના સભ્ય રહી શકશે નહિ.

ઠરાવ : ૩ આ સમાજ ઝોનોના તમામ સભ્ય પરિવારોએ પીરાણા સતપંથ ધર્મમાં કરવામાં આવતી મરતોત્તર દફન ક્રિયાઓમાં ભાગ લેવો નહિ, તેમજ તેને લગતી કોઈપણ ધાર્મિક ક્રિયાકર્મમાં ભાગ લેવો નહિ તેમજ તેમના જમણમાં હાજરી આપવી નહિ અને આવા કાર્યોનો સદંતર બહિષ્કાર કરવો.

ઠરાવ : ૪ આ સમાજ ઝોનોની કોઈપણ વ્યક્તિએ પીરાણા સતપંથ ધર્મની સમાજોના ધાર્મિક ઉત્સવો તેમજ ધાર્મિક સભાઓમાં ભાગ લેવો નહિ તથા તે અંગેના જમણવારના આમંત્રણનો સ્વીકાર કરવો નહિ, આપણી સમાજના ધાર્મિક હિન્દુ ઉત્સવો જેવા કે રામનવમી, જન્માષ્ટમી, નવરાત્રી, ધાર્મિક સતસંગ, ધાર્મિક પ્રતિષ્ઠા મહોત્સવ કે તેને લગતા સમુહ ભોજનના કાર્યક્રમોમાં પિરાણા સતપંથને માનતી કે અનુસરતી વ્યક્તિ યા પરિવાર તેમજ વ્યક્તિ સમુહને કોઈપણ પ્રકારનું આમંત્રણ આપવું નહિ.

ઠરાવ : ૫ (ક) આ સમાજ ઝોનોના કોઈ પણ સભ્યે તેમજ તેમના પરિવારે આજ દિવસ પછી દિકરા-દિકરીઓનાં સગપણ બાબત દિકરી આપવાનું તથા દિકરી લેવાનું સનાતન વૈદિક હિન્દુ ધર્મને પાળનારા પરિવારો સાથે કરવાનું રહેશે. પિરાણા સતપંથ ધર્મને માનનારા કોઈપણ ગામના કોઈપણ પરિવારો સાથે નવા સગપણ કે સંબંધો કરવા નહિ.

(ખ) આથી અગાઉ પીરાણા સતપંથ ધર્મને માનનારા પરિવારો સાથે કરવામાં આવેલ જૂના સંબંધોમાં આવતા સામાજીક વ્યવહારો જેવા કે લગ્ન, મામેરૂં તથા બોલામણું વગેરે પ્રસંગોમાં જઈ આવી શકાશે, પરંતુ તેવા પ્રસંગોના જમણવારમાં ભાગ લેવો નહિ.

ઠરાવ : ૬ આથી અગાઉ પીરાણા સતપંથ ધર્મને માનનારા પરિવારોમાં જૂના સંબંધોમાં (ફઈ, બહેન, દિકરી, સાસરીયું) મરણ વખતે દફન વિધિ તેમજ તેને લગતી કોઈ પણ પ્રકારની અંતિમ ક્રિયાઓમાં ભાગ લઈ શકાશે નહિ, પણ સામાજીક નીતિ-નિયમો પ્રમાણે થતો વ્યવહાર કરી અથવા ચૂકવીને પાછું આવવાનું રહેશે. તેમજ હિન્દુ ધર્મને ન છાજતી ઉત્તર ક્રિયામાં ભાગ લેવાનો રહેશે નહિ.

realpatidar.com

https://archive.org/details/bk1233/page/n1/mode/1up

Real Patidar
Unravel Truth

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

realpatidar.com

॥ શ્રી લક્ષ્મીનારાયણ વિજયતેતરામ્ ॥ ॥ સનાતન પરમો ધર્મ ॥ ॥ શ્રી ઉમિયા માતાય નમઃ ॥

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, ઉત્તર સાબરકાંઠા ઝોન (ગુજરાત)
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, દક્ષિણ સાબરકાંઠા ઝોન (ગુજરાત)
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ, સાબર રીજીયન (ગુજરાત)

તા. ૩૦-૧-૨૦૧૧
રવિવાર

આજ રોજ તા. ૩૦-૧-૨૦૧૧ ને રવિવારના રોજ સવારે ૯-૦૦ કલાકે મોડાસીયા કડવા પાટીદાર સમાજ કેમ્પસ, ને.હા. નં. ૮, સહકારી જીનની બાજુમાં, **હિંમતનગર** ખાતે મળેલ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, ઉત્તર સાબરકાંઠા ઝોન, શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, દક્ષિણ સાબરકાંઠા ઝોન અને શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ-સાબર રીજીયનને સાંકળતી વિવિધ સમાજો, મહિલા મંડળો અને યુવા મંડળોની એક અભૂતપૂર્વ સભા શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, નખત્રાણાના પ્રમુખ, **પાટીદાર શિરોમણી શ્રી રામજીભાઈ કરમસીભાઈ નાકરાણી**ના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મોટી સંખ્યામાં મહેમાનોની તથા સનાતની જ્ઞાતિજનોની ઉપસ્થિતિ રહી હતી.

આ સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ સર્વે સનાતની ભાઈઓ-બહેનો તરફથી રજુ થયેલ વિચારોનો સારાંશ અને શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, નખત્રાણા (કેન્દ્રીય સમાજ) દ્વારા તા. ૨૫-૩-૨૦૧૦ના રોજ બહાર પાડવામાં આવેલ **શ્વેતપત્ર** તેમજ તા. ૭-૫-૨૦૧૦ની કેન્દ્રીય સમાજની **અસાધારણ સામાન્ય સભા**માં સર્વાનુમતે બંધારણમાં કરાયેલ સુધારાઓ તથા તા. ૧૨-૫-૨૦૧૦ ના જ્ઞાતિના **પંચમ્ અધિવેશન**માં સર્વાનુમતે પસાર કરેલ જ્ઞાતિના રીત-રીવાજોની ૧ થી ૧૯ કલમો અને કેન્દ્રીય સમાજે તા. ૧-૭-૨૦૧૦ના રોજ બહાર પાડેલ આદેશોને અનુલક્ષીને જ્ઞાતિના રીત-રીવાજોની કલમ ૧૮ મુજબ **બાહ્ય આચરણો** અંગે તથા કલમ ૧૯ મુજબ **સામાજીક તથા ધાર્મિક પ્રશ્નો** અંગેનું પાલન ચુસ્તપણે કરવા શ્વેતપત્રમાં જણાવેલ છે.

સમાજ એક જ આચાર અને વિચાર વાળો રહે, સમાજમાં એક જ પ્રકારના રીત-રીવાજોનું અને સનાતન વૈદિક હિન્દુ ધર્મનું ચુસ્તપણે પાલન થાય તે અત્યંત જરૂરી છે. પાલન ન કરનાર વ્યકિત અથવા વ્યકિત સમૂહનું સભ્યપદ રદ કરવાની સમગ્ર જવાબદારી ભારતભરના તમામ ઝોન અને ઝોનમાં આવતા સમાજોને કેન્દ્રીય સમાજ દ્વારા સોંપવામાં આવેલ છે.

કેન્દ્રીય સમાજના આ આદેશોને અનુસરીને અને આજની આ **'સમજે પાટીદાર'** સભામાં થયેલ ચર્ચા વિચારણાના અંતે આજની સભા નિષ્કર્ષ પર આવી **નીચે મુજબના ઠરાવો સર્વાનુમતે પસાર કરે છે.**

<u>મંજુર થયેલ ઠરાવો</u> :

ઠરાવ : ૧ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, ઉત્તર અને દક્ષિણ સાબરકાંઠા ઝોન, શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ, સાબર રીજીયનના સભ્યો **સનાતન વૈદિક હિન્દુ ધર્મ**ને માનતા અને પાળતા કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના વંશજો જ રહી શકશે યા બની શકશે.

ઠરાવ : ૨ આ સમાજ ઝોનોના તમામ સભ્ય પરિવારોના બાહ્ય આચરણો જન્મ થી મરોત્તર સુધી શુધ્ધ વૈદિક સનાતન હિન્દુ તરીકેના હોવા જોઈએ અને પાળવાના રહેશે. તેમ ન કરનાર વ્યકિત આ સમાજ ઝોનના સભ્ય રહી શકશે નહિ.

ઠરાવ : ૩ આ સમાજ ઝોનોના તમામ સભ્ય પરિવારોએ પીરાણા સતપંથ ધર્મમાં કરવામાં આવતી મરતોત્તર દફન ક્રિયાઓમાં ભાગ લેવો નહિ, તેમજ તેને લગતી કોઈપણ ધાર્મિક ક્રિયાકર્મમાં ભાગ લેવો નહિ તેમજ તેમના જમણમાં હાજરી આપવી નહિ અને આવા કાર્યોનો સદંતર બહિષ્કાર કરવો.

ઠરાવ : ૪ આ સમાજ ઝોનોની કોઈપણ વ્યક્તિએ પીરાણા સતપંથ ધર્મની સમાજોના ધાર્મિક ઉત્સવો તેમજ ધાર્મિક સભાઓમાં ભાગ લેવો નહિ તથા તે અંગેના જમણવારના આમંત્રણનો સ્વીકાર કરવો નહિ, આપણી સમાજના ધાર્મિક હિન્દુ ઉત્સવો જેવા કે રામનવમી, જન્માષ્ટમી, નવરાત્રી, ધાર્મિક સતસંગ, ધાર્મિક પ્રતિષ્ઠા મહોત્સવ કે તેને લગતા સમુહ ભોજનના કાર્યક્રમોમાં પિરાણા સતપંથને માનતી કે અનુસરતી વ્યક્તિ યા પરિવાર તેમજ વ્યક્તિ સમુહને કોઈપણ પ્રકારનું આમંત્રણ આપવું નહિ.

ઠરાવ : ૫ (ક) આ સમાજ ઝોનોના કોઈ પણ સભ્યે તેમજ તેમના પરિવારે આજ દિવસ પછી દિકરા-દિકરીઓનાં સગપણ બાબત દિકરી આપવાનું તથા દિકરી લેવાનું સનાતન વૈદિક હિન્દુ ધર્મને પાળનારા પરિવારો સાથે કરવાનું રહેશે. પિરાણા સતપંથ ધર્મને માનનારા કોઈપણ ગામના કોઈપણ પરિવારો સાથે નવા સગપણ કે સંબંધો કરવા નહિ.

(ખ) આથી અગાઉ પીરાણા સતપંથ ધર્મને માનનારા પરિવારો સાથે કરવામાં આવેલ જૂના સંબંધોમાં આવતા સામાજીક વ્યવહારો જેવા કે લગ્ન, મામેરૂં તથા બોલામણું વગેરે પ્રસંગોમાં જઈ આવી શકાશે, પરંતુ તેવા પ્રસંગોના જમણવારમાં ભાગ લેવો નહિ.

ઠરાવ : ૬ આથી અગાઉ પીરાણા સતપંથ ધર્મને માનનારા પરિવારોમાં જૂના સંબંધોમાં (ફઈ, બહેન, દિકરી, સાસરીયું) મરણ વખતે દફન વિધિ તેમજ તેને લગતી કોઈ પણ પ્રકારની અંતિમ ક્રિયાઓમાં ભાગ લઈ શકાશે નહિ, પણ સામાજીક નીતિ-નિયમો પ્રમાણે થતો વ્યવહાર કરી અથવા ચૂકવીને પાછું આવવાનું રહેશે. તેમજ હિન્દુ ધર્મને ન છાજતી ઉત્તર ક્રિયામાં ભાગ લેવાનો રહેશે નહિ.

realpatidar.com

https://archive.org/details/bk1233/page/n3/mode/1up

ઠરાવ : ૭ આ સમાજ ઝોનો દ્વારા યોજાતા સમૂહ લગ્નમાં સનાતન વૈદિક હિન્દુ ધર્મને અનુસરનાર કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના પરિવારોના સંતાનો નો જ સમાવેશ કરવામાં આવશે.

realpatidar.com

ઠરાવ : ૮ આ સમાજઝોનોનો કોઈપણ વ્યક્તિ અથવા સભ્ય તેમજ તેમનો પરિવાર સતપંથ ધર્મને ત્યજી સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં પાછો આવવા ચાહે તો તેમને આવકારવામાં આવશે. પણ તેઓએ સનાતન ધર્મને અનુસરનાર સમાજ પાસેથી બાંહેધરી પત્ર લખાવી લાવવાનો રહેશે.

ઠરાવ : ૯ આ સમાજઝોનોમાં કોઈ પણ પીરાણા સતપંથ ધર્મને માનનાર વ્યક્તિ આ સમાજ ઝોનોનો સભ્ય હશે યા કારોબારી સભ્ય હશે, હોદ્દેદાર હશે તો તેનું સભ્યપદ રદ થઈ જતાં કારોબારી સભ્ય તેમજ હોદો આપો આપ રદ થઈ ગયો ગણાશે. સભ્ય તરીકે રદ થઈ ગયેલ કોઈ પણ સભ્યએ સમાજમાં ભરેલ કોઈ પણ **રકમ કે લવાજમ** પાછું આપવામાં આવશે નહિ અને તેવા સભ્યનો કોઈપણ પ્રકારનો સમાજ પર હક-દાવો રહેશે નહિ.

ઠરાવ : ૧૦ આ સમાજઝોન એક સનાતન વૈદિક હિન્દુ ધર્મને પાળતા લોકોની છે. તેના ઈષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને કુળદેવી શ્રી ઉમિયા માતાજી છે. સમાજ એને જ કહેવાય જ્યાં વ્યવસ્થિત લોકોનો જનસમુદાય એક જ ધર્મ (સનાતન વૈદિક હિન્દુ ધર્મ)ને પાળતો હોય, એકજ રીત-રિવાજને અનુસરતો હોય તેમજ એકજ આચાર-વિચારને વરેલો હોય. આ સમાજ ઝોનમાં એકતા જળવાય એ હેતુને ધ્યાનમાં લેતાં સમાજઝોનના દરેક સભ્યો તેમજ તેમના પરિવારોને ચુસ્ત પણે મૂળ સનાતન વૈદિક હિન્દુ ધર્મ પાળવા આ સમાજઝોન આદેશ કરે છે.

ઉપરોક્ત ઠરાવોનું પાલન આ સમાજઝોનના દરેક સભ્યોએ તેમજ તેમના પરિવારોએ કરવું ફરજીયાત રહેશે. તેમાં કોઈ પણ પ્રકારની ઢીલાસ, ચૂક તેમજ બાંધ છોડ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહિ. ઉપરોક્ત નીતિ-નિયમોનું ચૂસ્તપણે પાલન કરવું અને કરાવવું એ આ સમાજઝોનના દરેક સભ્ય તેમજ તેમના પરિવારની નૈતિક ફરજ બને છે.

આ સમાજઝોનનો કોઈપણ સભ્ય તેમજ તેમનો પરિવાર જો ઉપરોક્ત ઠરાવોનું ઉલ્લંઘન કરશે તો તે સમાજ ઝોનનો ગુનેગાર ગણાશે અને તેવા સભ્યનું સભ્યપદ રદ કરવામાં આવશે તેમજ તેવા સભ્યને ભવિષ્યમાં આ સમાજ ઝોનનું સભ્ય પદ આપવામાં આવશે નહિ તેમજ તેના પરિવારને આ સમાજ ઝોન દ્વારા યોજવામાં આવતા કાર્યક્રમો તેમજ પ્રસંગોમાં ભાગ લેવા દેવામાં આવશે નહિ. આ બાબતે બીજી કોઈ પણ અન્ય ચર્ચાઓ હાથ ધરવામાં આવશે નહિ.

આજ તારીખ ૩૦-૦૧-૨૦૧૧ના રોજ મળેલ સમાજ ઝોનો તથા યુવાસંઘની મળેલ સભામાં ઉપરોક્ત ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવેલ છે તે તારીખ ૩૦-૧-૨૦૧૧થી જ લાગુ પાડવામાં આવે છે.

આ ઠરાવોની નકલો બંને સમાજ ઝોનોના ગામે-ગામ અને ભારત ભરની સમાજોમાં મોકલવાનું પણ નક્કી કરવામાં આવે છે.

શ્રી સત્ય સનાતન ધર્મની જય, ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની જય, શ્રી ઉમિયા માતાજીની જય

શ્રી નરસિંહભાઈ ધનજીભાઈ રામાણી
પ્રમુખ
શ્રી અ.ભા.ક.ક.પા. સમાજ,
ઉત્તર સાબરકાંઠા ઝોન (ગુજરાત)

શ્રી પુનમભાઈ ખીમજીભાઈ ધોળુ
પ્રમુખ
શ્રી અ.ભા.ક.ક.પા. સમાજ,
દક્ષિણ સાબરકાંઠા ઝોન (ગુજરાત)

શ્રી સૌરભ અમૃતભાઈ રામાણી
પ્રમુખ
શ્રી અ.ભા.ક.ક.પા. યુવાસંઘ,
સાબર રીજીયન (ગુજરાત)

સભા પ્રમુખ
શ્રી રામજીભાઈ કરમસીભાઈ નાકરાણી
પ્રમુખ, શ્રી અ.ભા.ક.ક.પા. સમાજ, નખત્રાણા

realpatidar.com